



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ દ્વારા વેસ્ટર્ન રેલ્વે ના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ રાજકોટ આવતા તેઓની મુલાકાત લઈ રાજકોટ ડિવિઝનના રેલ્વે ને લગતા વિવિધ પ્રશ્નો તેમજ સૂચનો રજૂ કરવામાં આવેલ.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા તથા માનદ્વંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ મુંબઈ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરશ્રી આલોક કંસલની રાજકોટ ખાતે મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરો હજારોની સંખ્યામાં રાજકોટ રેલ્વે સ્ટેશનેથી મુસાફરી કરતા હોય તેઓને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે રાજકોટ ડિવિઝનના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો તેમજ સૂચનો રજૂ કરેલ જેમાં :-

- (૧) રાજકોટના રેલ્વે સ્ટેશનમાં એસ્કેલેટરનું ભુમી પુજન ઘણા સમયથી થઈ ગયેલ છે તેથી તેનું કામકાજ તાત્કાલી શરૂ કરી મુસાફરોને એસ્કેલેટરની સુવિધા આપવા બાબત.
- (૨) રાજકોટ-સુરેન્દ્રનગર ડબલટ્રેક માટે રાજ્ય સરકારશ્રી દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી પુર્ણ થઈ ગયેલ છે તેથી ડબલટ્રેકની કામગીર તાત્કાલીક પુર્ણ કરવી.
- (૩) ગુજરાતના મોટા ભાગના મુસાફરો બોરીવલી સુધી સફર કરતા હોય ત્યારે ટ્રેઈન નં.૧૨૨૬૮/૧૨૨૬૭, રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરન્તો એક્સપ્રેસ ટ્રેઈનને બોરીવલી સ્ટેશને સ્ટોપ આપવો ખુબ જરૂરી છે.
- (૪) મુંબઈ માટે રાજકોટ-સૌરાષ્ટ્રનો ટ્રાફિક પુષ્કળ પ્રમાણમાં હોવાથી હમસફર એક્સપ્રેસ ટ્રેઈનનં.૨૨૯૨૩ હાલમાં એકાંતરાને બદલે દરરોજ શરૂ કરવી જોઈએ.

(પ) રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરો માટે ટ્રેઈન નં.૨૨૯૧૯/૨૨૯૨૦ હમસફર એક્સપ્રેસ અમદાવાદ-મદ્રાસ-અમદાવાદને રાજકોટ સુધી લંબાવવી.

(ક) ઘણાં મુસાફરો ઓખા તથા મથુરા શહેર વચ્ચે મુસાફરી કરતા હોય તેઓની સુવિધા અર્થે અઠવાડિયામાં એક વખત ઓખા-દિલ્હી (વાયા મથુરા) નવી ટ્રેઈન શરૂ કરવી. આ બાબતે રાજકોટ ડીવીઝન દ્વારા ફીઝીબીલીટી રીપોર્ટ હેડ ઓફિસમાં તૈયાર કરી મોકલાવી દીધેલ છે.

(ગ) મુસાફરો માટે રાજકોટ થી હરિદ્વાર ટ્રેઈન અઠવાડિયામાં ત્રણ વખત શરૂ કરવી.

(ઠ) મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર સ્કેનરની તાત્કાલીક વ્યવસ્થા કરવી જરૂરી છે.

(ડ) હાલની અનાધિકૃત પ્રવૃત્તિઓને ધ્યાને લઈ રાજકોટના તમામ રેલ્વે સ્ટેશનો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવી તથા પ્રવેશ ગેઈટ અને પાર્સલ ઓફિસમાં સામાન સ્કેનીંગની વ્યવસ્થા કરવી.

રેલ્વેના ઉપરોક્ત પ્રશ્નો - સુચનો અંગે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરશ્રી આલોક કંસલ દ્વારા મુસાફરોની સુવિધા માટે તુરંત યોગ્ય કરવા ખાત્રી આપેલ.